



વડોદરા મહાનગર સેવા સદન

પાણી/ડ્રેનેજનો પરવાનો મેળવવા માટેનું અરજી ફોર્મ

(૧)	અરજદારનું નામ (અટક પહેલા લખવી)	
(૨)	કાયમી સરનામું	
(૩)	ધંધાનું સરનામું	
(૪)	જન્મ તારીખ	
(૫)	શૈક્ષણિક લાયકાત	
(૬)	અનુભવની વિગત	

તારીખ : / /

અરજદારની સહી

અરજદારે ઉમર, શૈક્ષણિક લાયકાત અને અનુભવના સર્ટીફિકેટોની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. પ્લમ્બીંગ અંગેના નિયમો વાંચ્યા છે અને અમોને કબૂલ મંજૂર છે.



વડોદરા મહાનગર સેવા સદન

પાણી/ડ્રેનેજનો પરવાનો મેળવવા અંગેની શરતો (ધારાધોરણ)

૧. પ્લમ્બીંગ લાઇસન્સ (પરવાના) ની માંગણી કરનારની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ રહેશે.
(અ) એસ. એસ. સી. પાસ હોય તો ૫ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
(બ) ધોરણ ૭ પાસ હોય તો ૧૦ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
(ક) આઈ.ટી.આઈ. અગર સરકાર માન્ય સંસ્થાનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને ૩ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
૨. પ્લમ્બીંગ લાયસન્સની માંગણી કરનારની ઉંમર ઓછામાં ઓછી ૨૩ વર્ષની હોવી જોઈએ.
૩. પ્લમ્બીંગ લાયસન્સની માંગણી કરનારને અનુભવનું સર્ટીફિકેટ આપનાર લાયસન્સ પ્લમ્બરને ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તેનો પુરાવા રૂપે અગાઉના વર્ષોની નોંધણી તાજી કરાવ્યાની ઝેરોક્ષ નકલ અરજી સાથે બીડેલી હોવી જોઈએ.
૪. પ્લમ્બીંગ લાયસન્સ માટે અરજી કરનાર ઉમેદવાર તેમનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (૩ નકલ) જન્મ દાખલાની નકલ રહેઠાણની વિગત (રેશનકાર્ડના દાખલાની ઝેરોક્ષ નકલ સાથે) અરજી સાથે બીડવાની રહેશે.
૫. પ્લમ્બીંગ લાયસન્સ મેળવવા માંગતા અરજદારે અત્રેથી દૈનિક પત્રમાં આપેલી જાહેરાતમાં જણાવ્યા મુજબ વિગત ફોર્મમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજીઓની ચકાસણી કરીને જે તે ઉમેદવારને પ્રત્યક્ષ ઇન્ટરવ્યુ માટે લેખિત જાણ કરી બોલાવવામાં આવશે. ઉત્તીર્ણ થનાર ઉમેદવારે ઠરેલી લાગત વિ. ભર્યા બાદ તેઓનો પરવાનો આપવામાં આવશે.
૬. મુદત પ્લમ્બીંગ લાઇસન્સ (પરવાના) રીન્યુ નહિ કરાવે તેવા પ્રસંગે આપેલ લાઇસન્સ (પરવાનો) રદ ગણાશે અને પરવાનેદારે નવેસર અરજી કરવાની રહેશે.
૭. મહાનગર સેવા સદનના ધારાધોરણ વિરુદ્ધ બીન પરવાનગીએ અગર ગેરકાયદેસર પાણી / ડ્રેનેજ જોડાણ (કનેક્શનો) કરવામાં આવે તેવા પ્રસંગે પરવાનેદારને કાયમ માટે કાળી ચાટીમાં મુકવામાં આવશે અને તેઓએ ભરેલ અનામત જમ કરવામાં આવશે.
૮. પ્લમ્બીંગ લાયસન્સની માંગણી કરનાર વ્યક્તિએ લાયસન્સ પ્લમ્બરના અનુભવ સર્ટીફિકેટ સાથે છેલ્લા પાંચ વર્ષમાં જે તે વ્યક્તિને મળેલ પગાર અંગેની પાવતી કે પહોચની ખરી નકલ જે તે લાયસન્સ પ્લમ્બર પાસેથી મેળવી રજુ કરવાની રહેશે.
૯. લાયસન્સ પ્લમ્બરની માંગણી કરનાર વ્યક્તિએ સરકારશ્રીના ઠરાવેલ બે ગેઝેટેડ ઓફિસર પાસેથી સારી ચાલ-ચલગત અને ઓળખાણ અંગેનું પ્રમાણપત્ર મેળવી અસલમાં રજુ કરવાનું રહેશે. તેમજ નોંધણી તાજી કરાવતી વખત પણ સદરની અસલ કોપી આપવાની રહેશે.
૧૦. લાયસન્સ રીન્યુ કરાવતી વખતે જે તે લાઇસન્સ પ્લમ્બરે વર્ષ દરમિયાન કરેલ કામોના દાખલા જે તે વોર્ડ શાખાના અધિકારીશ્રીની સહી સાથે રજુ કરવાના રહેશે.
૧૧. વડોદરા શહેરના વિસ્તારમાં જ્યારે જ્યારે કોઈપણ પ્લમ્બર દ્વારા પાઈપ નાંખવાની કામગીરી ચાલતી હોય ત્યારે લાયસન્સ પ્લમ્બર સ્થળ પર હાજર હોવા જોઈએ અથવા તેના અધિકૃત વ્યક્તિ કે જેમને લાયસન્સ પ્લમ્બરે લેખિત અધિકૃત કરેલ હોય તેવી વ્યક્તિને સ્થળ પર હાજર રાખવાની રહેશે.
૧૨. દરેક અરજદાર લાઇસન્સ પ્લમ્બરના ઇન્ટરવ્યુમાં આવતી વખતે કનેક્શન અંગેના મહાનગર સેવા સદનના ધારાધોરણ તથા નિયમોથી વાકેફ હોવા જોઈએ અને ઇન્ટરવ્યુ લેનાર અધિકારીને સંતોષ થાય તો જ પરવાનો મંજૂર કરવામાં આવશે.
૧૩. અરજદારે અરજી સાથે જરૂરી સાધનિક કાગળો રજુ નહી કરેલ હશે તેવા પ્રસંગે અરજી દફતરે કરવામાં આવશે.
૧૪. અરજદારને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે અને જો અરજદાર હાજર નહીં રહેશે. તેવા પ્રસંગે અરજી દફતરે કરવામાં આવશે.
૧૫. પરવાનાના ધારાધોરણ અથવા તો નિતિ નિયમો અંગે કોઈ વિસંગતા ઉભી થાય તેવા પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે.
૧૬. જાહેર રોજગાર યોજના હેઠળ પ્લમ્બીંગ તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવારને પ્લમ્બીંગ લાયસન્સ માટેની લાયકાત યોગ્ય ગણવાના છે તથા તેઓએ એપ્રેન્ટીશીપનો એક વર્ષનો અનુભવ જાણવા પ્લમ્બીંગ કામનો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

કાર્યપાલક ઇન્જનેર

વડોદરા મહાનગર સેવા સદન